

Seat No.: \_\_\_\_\_

Enrolment No. \_\_\_\_\_

**GUJARAT TECHNOLOGICAL UNIVERSITY**  
**Diploma Engineering Semester –III Examination Dec. 2011**

**Subject code: 330302**

**Date: 29/12/2011**

**Subject Name: Human Biology**

**Time: 10.30 am – 01.00 pm**

**Total Marks: 70**

**Instructions:**

- 1. Attempt all questions.**
- 2. Make suitable assumptions wherever necessary.**
- 3. Figures to the right indicate full marks.**
- 4. English version is considered Authentic.**

<b>Q.1</b>	(a) Draw and explain structure of cell in detail.	<b>07</b>
	(b) Explain different type of Blood Groups.	<b>07</b>
<b>Q.2</b>	(a) Draw and Label internal Structure of Human Heart. Explain Anatomy of Heart.	<b>07</b>
	(b) Explain WBC in detail with it's Function and Formation.	<b>07</b>
	<b>OR</b>	
	(b) Explain Conduction System of Heart.	<b>07</b>
<b>Q.3</b>	(a) Enlist and Explain the hormones secreted by female reproductive system with its function.	<b>07</b>
	(b) Explain the Structure of Spinal cord.	<b>07</b>
	<b>OR</b>	
<b>Q.3</b>	(a) What is ECG ? Describe ECG wave in detail.	<b>07</b>
	(b) Write Short note on Blood Composition.	<b>07</b>
<b>Q.4</b>	(a) Explain Respiratory System of Human Body.	<b>07</b>
	(b) Explain Anatomy of Eye.	<b>07</b>
	<b>OR</b>	
<b>Q. 4</b>	(a) Draw and Explain Structure of Kidney.	<b>07</b>
	(b) Draw and Explain Structure of Neuron	<b>07</b>
<b>Q.5</b>	(a) Explain Male Reproductive System.	<b>07</b>
	(b) Explain Anatomy of Ear with its internal Structure of Outer, Inner and Middle Ear.	<b>07</b>
	<b>OR</b>	
<b>Q.5</b>	(a) Write Short note on Peripheral and Autonomic Nervous system.	<b>07</b>
	(b) Describe the Structure Location and Function of Testes.	<b>07</b>

\*\*\*\*\*

<b>પ્રશ્ન-૧</b>	અ	કોષનું બંધારણ આકૃતિ દોરી અને સમજાવો.	07
	બ	રુધિર જુથના પ્રકારો આપી તેના વિશે માહિતિ આપો.	07
<b>પ્રશ્ન-૨</b>	અ	હદયની આંતરિક રચના ની નામ નિર્દેશ સહિત આકૃતિ દોરી શરીર રચના સમજાવો.	07
	બ	શેતકણ સહ વિસ્તાર તેની ઉત્પત્તિ અને કાયે સાથે સમજાવો. <b>અથવા</b>	07
	બ	હદયના ધબકવાની કિયાની તાલબદ્ધતા અને નિયમન સમજાવો.	07
<b>પ્રશ્ન-૩</b>	અ	સ્રીના પ્રજજનન તંત્રમા થી ઉદભવતા જાતિય અંતસ્ત્રાવો ના નામ અને કાર્ય સમજાવો.	07
	બ	કરોડરજ્જ ની રચના સમજાવો. <b>અથવા</b>	07
<b>પ્રશ્ન-૪</b>	અ	ઇ.સી.જી. શુ છે ? તેમાથી ઉદભવતા તરંગો વણેંવો.	07
	બ	રુધિર ના બંધારણ પર ટુંક નોંધ લખો.	07
<b>પ્રશ્ન-૫</b>	અ	મનુષ્ય નુ શ્વસનતંત્ર સમજાવો.	07
	બ	આંખ ની રચના આકૃતિ દોરી સમજાવો. <b>અથવા</b>	07
<b>પ્રશ્ન-૬</b>	અ	મુત્રપિંડ નુ બંધારણ આકૃતિ દોરી સમજાવો.	07
	બ	ચેતાકોષ નુ બંધારણ આકૃતિ દોરી સમજાવો.	07
<b>પ્રશ્ન-૭</b>	અ	પુરુષ ના પ્રજનનતંત્ર વિશે સમજાવો.	07
	બ	કાન ની બાહ્ય, મધ્ય અને અંત: ભાગો ની રચના આકૃતિ દોરી સમજાવો. <b>અથવા</b>	07
<b>પ્રશ્ન-૮</b>	અ	પેરિફરલ અને ઓટોનોમિક નવાંસ સિસ્ટમ પર ટુંક નોંધ લખો.	07
	બ	શુક્કપિંડ નુ બંધારણ સ્થાન અને કાર્ય સમજાવો.	07

\*\*\*\*\*